

ઘઉના પરાળનું પોષણ મુલ્ય વધારવાની

વૈજ્ઞાનિક પદ્ધતિ



* ડૉ. શરદ એમ. સોની * ડૉ. મનીષ વી. પટેલ

: પ્રકાશક :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

ગાણપત્ર યુનિવર્સિટી

મહેસાણા ડિસ્�્રીક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન

મહેસાણા-ગોઝારીયા હાઇવે, ગાણપત્ર વિધાનગર-૩૮૮૦૧૨

તા.જી. મહેસાણા.

ફોન : (૦૨૭૬૨) ૨૮૬૧૮૮

જે કૂત મિત્રો જે મણો ઘઉં કર્યા હશે તે ઓએ કાપણી કરી લીધી હશે અને ઘઉં કાઢી લીધા હશે. ઘઉં આપણા ઉપયોગ માટે અને પરાળ પશુઓના ઉપયોગ માટે ઉપલબ્ધ થયું છે. ભૂતકાળમાં ઘઉંના પરાળનો ઉપયોગ આપણે પશુને ખવડાવવામાં કરતાં હતા. આજના દિવસોમાં અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિના હિસાબે ચારાના ભાવ ફૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, એટલે આપણે ઘઉંનું પરાળના છૂટકે પશુને ખવડાવવાનું શરૂ કર્યું છે. ઘઉંના પરાળમાં નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબના પોષક તત્ત્વો હોય છે.

ઘઉંના પરાળમાં પોષક તત્ત્વો

ઘઉંનું પરાળ	પ્રોટીન	તૈલિ પદાર્થો	રેખાવાળા ભાગ	મેંદાવાળા પદાર્થો	કુલ
લેબોરેટરીના પૃથકરણમાં ઉપલબ્ધ થયેલ પોષક તત્ત્વો	૨.૪	૧.૩	૪૩.૭	૪૧.૭	૮૮.૨
પશુના પાચન તંત્રમાં શોષાતા પાચય તત્ત્વો	૦.૨	૦.૫	૩૩.૫	૨૧.૭	૫૫.૯

પ્રોટીન જેવું મહત્વનું તત્ત્વ ઘઉંના પરાળમાં ૨.૪ ટકાના પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે પણ એનું પાચન ફક્ત ૦.૨ ટકા જે ટલું જ થાય છે. આનો અર્થ એવો થાય છે કે મોટા ભાગનું પ્રોટીન પરચા વગરનું છાણમાં નીકળી જાય છે. આમ હોવાથી પશુને જ્યારે ઘઉંનું પરાળ ખવડાવવામાં આવે છે ત્યારે એનું શરીર નભી જાય છે, પણ એનું શરીર તગડું થતું નથી. પશુ દૂધ આપતું હોય તો દૂધમાં વધારો થતો નથી. ઘઉંના પરાળનું પ્રોટીન તત્ત્વ ન પચાવાનું કારણ છે, એમાં રહેલ લાકડીયું તત્ત્વ (લીગનીન) ઘઉંનો છોડ પરિપક્વ થાય ત્યારે એમાં દાણા બેસે છે અને જે ભાગ પરાળ રૂપે વાપરીયે છી એ ખરેખર એનું થક છે. આ થકમાં લીગનીનનું તત્ત્વ હોય છે. જે પશુના ૪૮ સેલ્યુલોઝને પચાવવાની શક્તિ ઘરાવે છે. પરંતુ લીગનીન સાથે ઉપર દર્શાવ્યા મુજબના મજબૂત રાસાયનિક બંધનથી સંચોઝયેલા હોય છે. આ રાસાયનિક બંધનના હિસાબે આ તત્ત્વો લીગનીનથી છૂટાં પડતા નથી અને પશુના પેટમાં પચતાં નથી અને છાણમાં નીકળી જાય છે. આપણું પશુધન


મુખ્યત્વે ખેતીની આડપેદાશો પર નીભાવવામાં આવે છે. એવા સંજોગોમાં ઉપલબ્ધ ચારામાંથી આવી રીતે પુરતું પોષણ ન મળે એ બાબત પશુ પોષણનાં યૈઝાનિકો માટે એક મોટો પ્રશ્ન બની ગયો. યૈઝાનિકો એ આ વિષય પર પ્રયોગશાળામાં સંશોધન કરી ધર્ભના પરાળમાં લીનીન અને અન્ય પોષક તત્ત્વોના રાસાયણિક બંધનને નબળું પાડવા માટે એક પ્રક્રિયા વિકસાવી. આ પ્રક્રિયાથી ધર્ભના પરાળનું પાચ્ય પ્રોટીન લગભગ ૩ (ત્રણ) ટકા જેટલું થઈ જાય છે, એટલે આ પરાળ જુવારના બાંટા જેટલું કસવાળું બની જાય છે.

આ પ્રક્રિયા પશુપાલકો ઘર આંગણે કરી શકે એટલી સરળ છે. અને તેમની પાસે ઉપલબ્ધ સાધનોમાંથી થઈશકે એવી બાબત છે. ધર્ભના પરાળની યુરિયા પ્રક્રિયા માટે નીચે મુજબની વસ્તુઓની જરૂરિયાત રહે છે.

૧. ૧૦૦ કિ.ગ્રા. પરાળ દીઠ રક્ખિ.ગ્રા. યુરિયા.
૨. ૧૦૦ કિ.ગ્રા. પરાળ દીઠ ૫૦ લિટર પાણી રાખવા એક મોટું પીપ અને ૨૦ લિટર પાણી રહેતે વી એક બાલદી.
૩. પરાળના ઢગલાં ઢાંકવા માટે ખાતરની પ્લાસ્ટિકની યેલીમાંથી બનાવેલ એક મોટી ચાદર.
૪. વજન કરવા માટે નો સ્પ્રીંગ કાંટો.
૫. પાણી માપવા માટે નું લીટર નું માપ.
૬. પરાળની હેરફેર માટે મોટો ટોપલો નંગ - ૧ (એક)

પ્રક્રિયા કરવા માટે નીચે મુજબ તબક્કા વાર કાર્યવાહી કરવી.

૧. સો પ્રથમ જયાં પ્રક્રિયા કરવા પરાળનો ઢગલો રાખવો હોય તે જગ્યા નક્કી કરો.



૩. એક જગ્યા એ નાની ચાદર પાથરી તેના પર ૧૦૦ કિ.ગ્રા. પરાળ ટોપલામાંથી ઠાલવો.

૨. મોટા ટોપલામાં રહેલો પરાળનો જથ્થો સ્પ્રીંગ કાંટા પર વજન કરી નક્કી કરો, જેથી ટોપલાના માપથી ઓક્કસ વજનનું પરાળવા પરીશકાય.



૪. એક પીપળમાં ૫૦ લિટર પાણી લઈ તેમાં ૪ કિ.ગ્રા. ચુરિયા ઓગાળો અને આ ૧૦૦ કિ.ગ્રા. પરાળના જથ્થાં પર ૫૦ લિટર ચુરિયા દ્રાવણ છાંટો. દ્રાવણ છાંટાંચ જાચ એટલે આ પરાળને જચાં ઢગલો બનાવવાનાનો છે ત્યાં પાથરી દો. ત્યારબાદ બીજા થર માટે ફરી નાની ચાદર પર ૧૦૦ કિ.ગ્રા. પરાળ પાથરી ઉપર જણાવ્યા મુજબ ચુરિયાનું દ્રાવણ છાંટો અને તેને અગાઉનો જે થર બનાવેલ છે તેની ઉપર પાથરી દો. આમ, પરાળની અનુકૂળતાપ્રમાણે પથી ૧૦ થરકરો.

૫. થરગોઠવવાની કામગીરી પૂરી થાય એટલે આ થરપર થોડા સાદો પ્રક્રિયા વગરના પરાળનો થર કરો. હવે આ ઢગલાં પર મોટી ચાદર ઓફાડી દો. જમીન પર ચાદર અડે ત્યાં ઢગલાં નીચે દબાવી અને ફરતે માટીની પાળી કરી દો. જેથી છેડાં બરોબર દબાયેલાં રહે. ચાદર કોઈ જગ્યાએ ફાટેલી હોય તો એ જગ્યાએ છાંણા-માટીના મિશ્રણનો ગારો બનાવી ચોપડી દો. જેથી ત્યાંથી હવાની કળી શકશે નહિં. આ ઢગલાંની આજુ બાજુ કાંટામુકી દો જેથી એને કોઈ નુકશાન નથાય.

આ રીતે બંધ કરેલા ઢગલાંને ૨૧ દિવસ બંધ રાખવો પડે છે. આ સમયગાળામાં ચુરિયામાંથી એમોનિયા વાયું છૂટો પડે છે અને એમોનિયા પ્રક્રિયા કરીને પરાળના લાકડીયા તત્ત્વના (લીનીન) અને પોષક તત્ત્વ સાથે બંધનને નબળું પાડે છે. આથી આવું પરાળ જચારે ખવડાવીએ છી એ ત્યારે એમાંનું પ્રોટીન અને બીજા તત્ત્વો જે લાકડીયા તત્ત્વો સાથે સંચોજાયેલા હોય છે, તે પશુના પેટમાં છૂટાં પડે છે અને પશુના પાચનતંત્રમાં શોખાઈને પોષણ પુરું પાડે છે. વૈજ્ઞાનિકોએ સિદ્ધય કર્યું છે કે ઘઉંના આવી પ્રક્રિયા કરેલા પરાળમાંથી ૨-૩ ટકા પ્રોટીન અને ૫૦ ટકા જેટલા કુલ પાચયતત્ત્વો મળે છે. પરાળ ખવડાવતી વખતે ઉપરની ચાદર ચથાવત રાખી ઢગલાંને નીચેની બાજુ એથી ખોળીને ખવડાવવો. ખવડાવવા માટે જોઈતો જથ્થો બે ત્રણ કલાક પહેલાં કાઢી ખુલ્લો મુકો, જેથી એમાંથી એમોનિયાની વાસ નીકળી જશે. શરૂઆતના તબક્કામાં ચુરિયા પ્રક્રિયા કરેલ પરાળનો જથ્થો મોટા પશુને ઓછા પ્રમાણમાં આપો અને ધીમે-ધીમે આવા પરાળનું પ્રમાણ વધારતાં જાવ.